

પ્ર.૧

- (અ) ગાર્ડન સિલ્ક મીલ્સ લિમિટેડની વર્ષ ૨૦૧૫ દરમ્યાન કુલ મિલ્કતો રૂ. ૫૦૦૦૦૦૦ અને વેચાણ રૂ. ૮૦૦૦૦૦૦ હતું. તેનો કરવેરા પછીનો નફો રૂ. ૩૦૦૦૦૦ છે. કરવેરાનો દર ૪૦%. વર્ષ ૨૦૧૬ના અંદાજીત આંકડાઓ નીચે મુજબ છે.
વેચાણ રૂ. ૬૦૦૦૦૦૦ અને કરવેરા પછીનો નફો રૂ. ૩૩૦૦૦૦ છે. કુલ મિલ્કતો રૂ. ૬૦૦૦૦૦૦.
જો અંદાજીત આંકડાઓ હાંસલ કરવામાં આવે તો રોકાણેલી મૂડીના વળતરમાં શું બદલાવ થશે.
- (બ) મથુરી લિમિટેડના ચોપડામાંથી નીચેની માહિતી મળેલ છે. (૦૭)

| | |
|---------------------------------------|-------------|
| ચોખ્ખું વેચાણ | રૂ. ૫૦૦૦૦૦૦ |
| ચોખ્ખો કાર્યકારી નફો | રૂ. ૧૨૦૦૦૦૦ |
| સરેરાશ કુલ મિલ્કતો | રૂ. ૩૦૦૦૦૦૦ |
| શેર હોલ્ડરોનું ભંડોળ | રૂ. ૨૦૦૦૦૦૦ |
| વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો | રૂ. ૭૦૦૦૦૦ |
| તમારે નીચે પ્રમાણેની ગણતરી કરવાની છે. | |

(અ) સંચાલકો માટે રોકાણેલી મૂડી પર વળતરનો દર

(બ) શેરહોલ્ડરો માટે વળતરનો દર

- પ્ર.૨ મૂલ્ય વૃદ્ધિનો અર્થ અને લાભો સમજાવો. મૂલ્ય વૃદ્ધિ પત્રક નફા-નુકશાન ખાતાથી કેવી રીતે અલગ છે. (૧૫)

અથવા

- પ્ર.૨ નીચેની બાકીઓ વર્ષ ૨૦૧૭ના વર્ષની કરવેસ્ટી લિમિટેડના ચોપડામાંથી મળેલ છે. (૧૫)

| વિગતો | રકમ (રૂ.) |
|--------------------------------|-----------|
| વેચાણ | ૨૩૦૦૦૦૦ |
| પ્લાન્ટ અને મશીનરી (ચોખ્ખી) | ૧૦૮૦૦૦૦ |
| મશીનરી વેચાણની ખોટ | ૭૫૦૦૦ |
| પ્લાન્ટ અને મશીનરીનો ઘસારો | ૨૦૦૦૦૦ |
| સામાન્ય શેર પરનું કિલિડન્ડ | ૧૪૬૦૦૦ |
| દેવાદારો | ૧૯૫૦૦૦ |
| લેણદારો | ૧૨૭૦૦૦ |
| માલ સામાનનો કુલ સ્ટોક: | |
| ચાલુ કામ અને તૈયાર માલ: | |
| શરૂઆતનો સ્ટોક | ૧૬૦૦૦૦ |
| આખર સ્ટોક | ૨૦૦૦૦૦ |
| કાચા માલની ખરીદી | ૬૨૫૦૦૦ |
| બેન્ક સિલક | ૬૮૦૦૦ |
| પ્રિન્ટીંગ અને સ્ટેશનરી | ૨૨૦૦૦ |
| ઓફિસરનું મહેનતાણુ | ૨૮૦૦૦ |
| જાળવી રાખેલ નફો (શરૂઆતની બાકી) | ૬૯૪૦૦૦ |
| વર્ષનો જાળવી રાખેલ નફો | ૨૮૮૦૦૦ |
| ભાડુ, કર અને વેરા | ૧૬૫૦૦૦ |
| અન્ય ખર્ચા | ૮૫૦૦૦ |
| બહાર પાડેલ સામાન્ય શેર મૂડી | ૧૫૦૦૦૦૦ |
| ઉછીના લીધેલા નાણાં પરનું વ્યાજ | ૪૦૦૦૦ |
| વર્ષનો આવકવેરો | ૨૭૬૦૦૦ |
| મજૂરી અને પગાર | ૩૨૭૦૦૦ |
| કર્મચારીનો રાજ્ય વિમા પ્રીમીયમ | ૩૫૦૦૦ |
| ભવિષ્ય નીધિમાં ફાળો | ૨૮૦૦૦ |